



ગાંધીજીના ધર્મ અંગેના વિચારો

ડૉ. એરુજીશાબેન એમ. પટાણ

અસોસિયેટ પ્રોફેસર,

વૈદ્ય શ્રી એમ. એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, અમદાવાદ

૧. પ્રસ્તાવના

આધુનિક ટેક્નોલોજીના યુગમાં સમયના પ્રવાહની સાથે લોકોના જીવન, સંકલ્પો, સહેગીકરણી વગેરે પરિવર્તન પામ્યા છે, પરંતુ ન બદલાય એવી એક જ બાબત છે અને તે છે ધર્મ. ધર્મ એ દરેક વ્યક્તિને મળેલ વારસાગત ભેટ છે. જેને તે આજીવન વળગી રહે છે. દરેક વ્યક્તિને મન તેનું ધર્મ જ મહાન છે. હકીકતમાં દરેક ધર્મમાં જે સર્વ સામાન્ય તત્ત્વ છે તેના આધાર પર માનવધર્મનું નિર્માણ થયું જોઈએ. ભારત જીવા બિન સાંપ્રદાયિક દેશની અનિવાર્યતા છે કે માનવધર્મને જે મહત્વ મળે. આજે ભારત અને પાકિસ્તાનમાં વસતા મુસ્લિમો વચ્ચે ઐક્ય સ્થપાય અથવા અમેરિકામાં વસતા હિન્દુઓ માટે ભારતના હિન્દુઓ ને સફાનુભૂતિ જાગે, એના કરતા ભારતમાં રહેતા બધા ધર્મના લોકો એક બીજા સાથે હળીમળીને રહે, એક બીજા માટ સહિષ્ણ બને એ આજના યુગની તાતી જરૂરિયાત છે. ટેક્નોલોજી ક્ષેત્ર તો આપણે હરાગણ પ્રગતિ કરી છે. પરંતુ જો આપણે મન પર વિજય મેળવીશું તો ગાંધીજીની સંકલ્પનાઓ સાકાર કરી સર્વ ધર્મ સમભાવ સ્થાપી શાંતિપૂર્ણ જીવન જીવી શકીશું. જો આપણે ગાંધીજીના ધર્મ અંગેના વિચારોને અમલી બનાવ્યા હોત તો આજે ભારતની સ્થિતિ કાંઈક જુદી હોત! પ્રસ્તુત સંશોધન લેખમાં સંશોધકે ગાંધીજીના ધાર્મિક વિચારો પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે.

૨. ધર્મની વિભાવના

ધર્મ શબ્દ ‘ધૂ’ ધાતુ પરથી બન્યો છે. ધાર્યાતિ ઇતિ ધર્મ :। જે જીવનને, જગતને, ચરાચરને, સર્વ જે કાંઈ છે તે દરેકને ધારણ કરનાર તત્ત્વ તે ધર્મ.

‘ઓપચારિક ધર્મ કે ઇદ્ઘિત ધર્મને નહિ પણ જે બધા જ ધર્મના પાયામાં રહેલો છે અને જે આપણને આપણા સર્જનહારનું દર્શન કરાવે છે તેને હું ધર્મ કહું છું.’! - ગાંધીજી

ગાંધીજીએ ધર્મની વ્યાખ્યા બે-બે શબ્દોમાં આપતાં કહ્યું છે કે ‘ધર્મ એટલે નીતિ’, ‘ધર્મ એટલે સત્ય’, ધર્મ એટલે અંહિસા’, ‘ધર્મ એટલે પ્રેમ’ અને ‘ધર્મ એટલે કર્મા’.

ગાંધીજીના મતાનુસાર જે માણસની ખૂદ પ્રકૃતિને પણ પદ્ધી નાખે છે, જે માણસની તેની અંદર છે અને જે સદા પવિત્ર કરે છે તે ધર્મ છે. માનવપ્રકૃતિમાં રહેલું એ શાશ્વત તત્ત્વ છે. પોતાનો સંપૂર્ણ અવિર્ભાવ સિદ્ધ કરવા માટે ગમે તેવી ભારે કિંમત ચૂકવવા તે પાછો પડતો નથી તથા આત્મા પોતાને ઓળખે, પોતાના સર્જનહારને ઓળખે તથા તેની સાથે પોતાની વચ્ચેનો સાચો સંબંધ પિણાને ત્યાં સુધી તે તેને જંપવા હેતો નથી.

ધર્મ માણસને ઈશ્વર તરફ લઈ જતો માર્ગ છે. આમ ઈશ્વર તરફ લઈ જતાં જુદા જુદા માર્ગો બિન્ન-બિન્ન પ્રજાઓમાં અલગ અલગ સમયે પેદા થયાં અને ધર્મ તરીકે ઓળખાયાં. જેમાં હિન્દુ, જૈન, ઈસ્લામ, પિસ્તી, યહુદી, બૌધ્ધ, શીખ, પારસ્સી, કોન્કણિશિયસ વગેરે મુખ્ય છે. ગાંધીજી માને છે કે ધર્મો એક જ લક્ષ્ય પર પહોંચવા માટેના જુદા જુદા માર્ગો છે. જેટલી વ્યક્તિઓ છે તેટલા ધર્મો છે. તે જ રીતે સાચો અને પૂર્ણ ધર્મ એક જ છે પરંતુ માનવી ધ્વારા વ્યક્ત થઈને તે અનેક રૂપો ધારણ કરે છે.

3. સર્વધર્મ સમભાવ અંગે ગાંધીજીના વિચારો

ગાંધીજીએ દક્ષિણ આદ્યકાથી જ આશ્રમમાં પાર્થેનાનો પ્રારંભ કર્યો હતો. પાર્થેનામાં બધા જ ધર્મના લોકો જોડાતા. અન્ય ધર્મના લોકોને શ્લોક કે ભજનમાં કાંઈ સમજાતું નહીં. આ પરિસ્થિતિ પર વિચાર કરીને તેમણે સર્વ ધર્મનું જ્ઞાન મેળવ્યું. અંદો શ્રી રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ અસ્થાને નહિં ગણાય. તેમણે મુખ્ય અલગ-અલગ ધર્મ અમુક સમય માટે સંપૂર્ણપણે સ્વીકારીને પોતાનું દૈનિક જીવન બિલકૂલ તે મુજબનું ગોઠવ્યું અને એ જ રીતે તે ધર્મની જેમ જીવન જુદ્યા અને દરેક વખતે દશ્વરના સાક્ષાત્કાર કર્યો અને કહ્યું તમામ ધર્મના પાયાના સિદ્ધાંતો એક જ છે તેમાં કોઈ ફેરફાર નથી. આથી ગાંધીજીએ સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત અમલી બનાવ્યો અને પાર્થેનાઓ પણ સર્વધર્મ સમભાવ વાળી કરવાની પહેલ કરી. સર્વધર્મ સમભાવની સંકલના સ્પષ્ટ કરતા પહેલા દરેક ધર્મના પાયાના સિદ્ધાંતો ટૂંકમાં જોઈએ.

3. ૧ હિન્દુ ધર્મ

3. ૧. ૧ બાહ્યરૂપ

(૧) વર્ગ-વ્યવસ્થા (૨) આશ્રમ વ્યવસ્થા (૩) અનુષ્ઠાન

3. ૧. ૨ આંતરિક રૂપ

અષ્ટાંગ યોગ

(૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયમ (૫) પ્રત્યાહાર (૬) ધાર્યા (૭) ધ્યાન (૮) સમાપ્તિ
ચાર પુરુષાર્થ

(૧) ધર્મ (૨) અર્થ (૩) કામ (૪) મોક્ષ

3. ૧. ૩ જૈન ધર્મ

ઇન્દ્રિયો પર કાબુ મેળવવા તપનો સિદ્ધાંત

(૧) અહિંસા (૨) અપરિગ્રહ (૩) કાન્ત (સૌની જોવાની દસ્તિ અલગ)

ત્રિવિધ રીત (૧) સમયક દર્શન (૨) સમયક જ્ઞાન (૩) સમયક ચરિત્ર

3. ૧. ૪ બૌद્ધ ધર્મ

સર્વ દુઃખાનું કારણ તૃષ્ણા

ત્રણ સિદ્ધાંત (૧) મૈત્રી (૨) કર્મા (૩) મુદ્રિત-પ્રસેન્નતા

3. ૧. ૫ પિસ્તી ધર્મ

પ્રમનો સંદેશ

ચાર સિદ્ધાંતો (૧) પ્રેમ (૨) સેવા (૩) ક્ષમા (૪) શ્રદ્ધા

3. ૧. ૬ ઈસ્લામ ધર્મ

માઈચારાનો સંદેશ

પાંચ સિદ્ધાંત (૧) કલ્મા (૨) નમાઝ (૩) રોજા (૪) જફાત (૫) ફિલ

આદેશ (૧) પવિત્રતા (૨) શાંતિ (૩) માઈચારો (૪) સમાનતા (૫) ઈમાન.

ગાંધીજીએ ઉપરોક્ત પાંચેય ધર્મના મૂળભૂત તત્ત્વા વિષે વિચાર કર્યો. દરેક ધર્મનો મુખ્ય આશય માણસને વધુ સારો માનવ બનાવવાનો છે. સરવાળે બધાંજ સિદ્ધાંતો (સાદગુણો) સારા માણસ થવાં માટે પૂરતા છે. વળી બધાં જ સિદ્ધાંતો એવા છે કે કોઈ પણ ધર્મની વ્યક્તિને તે સ્વીકાર્ય હોય જ! આમ છીં આપણે જોઈએ તો માણસ પોતાની આંતરિક નભળાઈને લઈને શયતાનનો શિકાર બને છે. અને જ્યારે ભાનુમાં આવે છે ત્યારે ઘરણું મોડું થઈ ગયું હોય છે. ચિંતાનો વિષય એ છે કે કહેવાતા જે તે ધર્મના જેરખાં પાતાના ધર્મની રક્ષાને નામે એ ધર્મ પાળતી કોમને બીજા ધર્મ સામે ઉશ્કેરી અશાંતિ અને આંતક ફેલાવે છે. આવા દુષ્કૃત્યો ગગતરી પૂર્વક ગેરસમજ ફેલાવી વિફુત રજુઆત કરી, ભૂતકાળના પોપડા ઉજેડી જનતાને ગેરમગે દીરે છે. વિનોબાજી કહેતાં ઝગડો કદી ધર્મ-ધર્મ વચ્ચે હોતો જ નથી. ઝગડા ધર્મનો અધર્મ સામે હોય છે. સત્ય એ ધર્મ છે, અસત્ય અધર્મ છે. અહિંસા ધર્મ છે, હિંસા અધર્મ

છે. કરુણા ધર્મ છે, ફૂરતા અધર્મ. પ્રેમ ધર્મ છે, ધિક્કાર અધર્મ છે. શાંતિ ધર્મ છે, અશાંતિ અધર્મ છે. શું આ દિવા જેવું સત્ય નથી? ધર્મ અને ધર્માધતા વચ્ચે દિવસ અને રાત જેટલું અંતર છે. ધર્મ સર્વનો પ્રકાશ છે. ધર્માધતા અમાસની અંધારી રાત છે. જે હિંસા કરવા ઉશ્કે નિર્દીષોને રંજાડે, ગરીબની રોજુરોટી હડપી લે, બહેનોની આબરુ બરબાદ કરે, બાળો, લૂંટે, મારે –મલા આ ધર્મ કહેવાય ? અને છતાં આપણે જાગુણીએ છીએ કે ધર્મને નામે અત્યાચાર થાય છે.

ઉપરોક્ત પરિસ્થિતિને નિવારવાં ધર્મી-ધર્મી વચ્ચે સત્તુ બાંધવો આવશ્યક હતો. આવો સેતુ મહાત્મા ગાંધીજી એ બાંધી આયો. તેનું નામ છે સર્વધર્મ સમભાવ. આપણે આપણો ધર્મ પાળતા બીજાના ધર્મ માટે પણ સમભાવ રાખીએ. આવો સમભાવ માત્ર કહેવાંથી નથી આવતો અમલ જરૂરી છે.

**અમલ સે કિનંગી બનતી હૈ જનતા ભી જહનમ ભી
યે ખાકી અપની કિસ્મત મેં ના નૂરી હૈ ન નારી હૈ**

ગાંધીજીના મતાનુસાર સર્વ ધર્મ સમભાવ માટે અન્ય ધર્મનું અધ્યયન જોઈએ. તે ધર્મના મહાપુરુષો(સ્થાપકો)ના જીવનચરિત અને તેમના આચરણથી જ તે ધર્મની સાચી પ્રિતી થશે. અન્ય ધર્મ પાળનાર લોકો સાથે ધરોખો કુળવવાથી મોટા ભાગની ગેરસમજો દૂર થશે. આમ કરવાથી ખાત્રા થશે કે તે પણ આપણા જેવા જ સીધા, સરળ, પ્રેમાળ અને પરગજુ માણસો છે. તાજેતરની દેશની પરિસ્થિતિનો વિચાર કરીએ તો એક તરફ પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાઓ અંગે વારંવાર ચેતવણી આપવામાં આવે છે તો બીજી તરફ ચીને પોતાની લશકરી તાકાતનો પરચો બતાવ્યો છે તો વળી આપણી સરફણ પર કરી ૧૬૬૨ જેવી પરિસ્થિતિ સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. સંરક્ષણ તજ્જીવના મતાનુસાર ચીનની લશકરી તાકાત એટલી બધી છે કે આપણે તેનો સામનો કરવા માટે અસમર્થ છીએ. આવી પરિસ્થિતિમાં ભારતમાં વસતા સૌ નાગરિકોમાં એક્તા જન્મે એ અંત્યત જરૂરી છે. આ જ પરિસ્થિતિને અનુલક્ષીને તા. ૪-૧૦-૦૬ના સમાચાર પત્રના સંદર્ભમાં મુસિલમ પર્સનલ બોર્ડના ઉપાધ્યક્ષ લીધેલા નિર્ણય પ્રસ્તુત કરવામાં આવે છે.

“કુંમના મેળામાં શિયા મૌલ્દી કલ્યે સાદિક પણ ગંગામાં ડૂબકી લગાવશે.”

ચીનના ખતરાને જોતાં ઓલ ઇન્ડિયા મુસિલમ પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ અને શિયાઓના પ્રમુખ ધર્મગુરુ કલ્યે સાદિક જગ્યાવ્યું છે કે આ વાતાવરણમાં હિન્દુ-મુસિલમ એક્તાની સૌથી વધુ જરૂર છે.

શ્રી સાદિકે જગ્યાવ્યું કે, તેમણે હરિદ્વારના કુંમના મેળામાં ડૂબકી લગાવવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. શ્રી સાદિકે એમ પણ જગ્યાવ્યું કે અભિલ ભારતીય સાધુ પરિષદના રાષ્ટ્રીય સંયોજક યતીન્દ્ર ગિરિ મહારાજ સાથેની ચર્ચા દરમિયાન ચીનના ખતરાનો તેમને આભાસ થયો છે. સાદિકે જગ્યાવ્યું કે ચીન સતત ભારતને ડરાવવાનો પ્રયાસ કરી રહ્ય છે. કાશ્મીરના નાગરિકોને જુદી વિજા આપીને તેણે પોતાના ઠરાદા જાહેર કરી દીધા કે અગાઉ અરૂપાચલના નાગરિકોને પણ તેણે અલગ વિજા આપ્યા હતું.

ગાંધીજી પોતાના સર્વધર્મ સમભાવ અંગેના ઉચ્ચ વિચારોને લઈ વિશ્વ માનવ બની શક્યા. તેથી તેમની જન્મ જ્યંતિને ‘વિશ્વશાંતિ દિન’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગાંધી સપ્તાહ દરમ્યાન કાન્સમાં સોનાની પેન લાન્ય કરવામાં આવી જેની નીબ પર ગાંધીજીનો ફોટો અકિત કરવામાં આવ્યો છે. તો અમેરિકામાં એક ડોલરની ગાંધીજીના ફોટો વાળી ટેકીટ જારી કરવામાં આવી. વળી ઓબામાં એ પણ જો ગાંધીજી જીવતા હોત તો તેમની સાથે ભોજન કરવાની ઈચ્છા બ્યક્ટ કરી હોત.

૪. ધાર્મિક શિક્ષણ અંગે ગાંધીજીના મંતવ્યો

ગાંધીજી કહે છે કે ‘ધાર્મિક શિક્ષણનો પાયો ધર્મના સર્વસ્યર્થી તત્ત્વાનું શિક્ષણ તથા હદ્યને તેમજ જીવનને શુદ્ધ કરનાર સત્ય અને અહિંસાના સંદગ્યોની તાલીમ હોવી જોઈએ. દુનિયાના મહાન ધર્મી એક બીજાથી ચાહે કેટલાય લિન્ન હોય તો પણ મૂળભૂત બાબતમાં બિલકુલ એક છે કે અશુદ્ધ હદ્ય વાળો પુરુષ કે સ્ત્રો ઈશ્વરનાં સિંહાસન

આગામ જુદ શકે નહિ એટલા માટે મૂળભૂત સદગુરુઓનું કડક પાલન આધ્યાત્મિકતાનો નક્કર પાયો જનવો જોઈએ.''

શાળાઓમાં ધાર્મિક શિક્ષણની જરૂરીયાત વિષે ગાંધીજી આવો પ્રબળ મત ધરાવતા હોવાં છતાં વર્ધી ચોજાનમાંથી તેમણે ધાર્મિક શિક્ષણન ઈરાદાપૂર્વક બાદ રાખી તેમણે ધાર્મિક શિક્ષણનો સનૂળગો, છેદ ઉડાડી દીધો છે એમ કહેવું બરાબર નથી. તેમાંથી તેમણે આધ્યાત્મિક તાલીમના અર્થમાં ધાર્મિક શિક્ષણને નહિ પણ પ્રચલિત અર્થમાં સાંપ્રદાયિક ધર્મને તિલાંજલિ આપી છે. પોતાની કેળવણીની ફિલસ્ફૂરીયી સાંપ્રદાયિક શિક્ષણને દૂર રાખવા માટે તેમની પાસે સંગિન કારણો હતા. બાળકોના ગ્રહણશીલ ચિત્તમાં સંકુચિત દ્વારા કેળવવાનું વલણ રાખનાર સાંપ્રદાયિક શિક્ષણની હિમાયત તેઓ કેવી રીતે કરી શકે? સાંપ્રદાયિકતાને કારણે બધા યુગોમાં તથા બધા દેશોમાં માનવજાતને વેઠવી પડેલી ભારે આપત્તિઓનો આપણે વિચાર કરીએ તો ગાંધીજીની નીતિના શાળાપણ વિષે આપણે શંકા ઉઠાવવી ન જોઈએ. વળી, હિંદ પોતાની સમગ્ર પજા ઉપર રાજ્યનો ધર્મ ઠીકી બેસાડનાર ધર્મ શાઢી નથી. રાજ્ય પોતાનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ શિથિલ કર્યો વિનાં શાળાઓમાં ધાર્મિક શિક્ષણ આપવાની જોગવાઈ કરી શકે નહીં.

ગાંધીજી કહે છે કે “રાજ્યનો કોઈ એક ધર્મ ન હોય તો ધાર્મિક શિક્ષણ આપવું અશક્ય નહીં તો બહુ જ મુશ્કેલ થઈ જ પડે છે. કેમ કે એનો અર્થ એ થાય કે દરેક સાંપ્રદાયને માટે એવા શિક્ષણની વ્યવસ્થા રાખવી જોઈએ. એવું શિક્ષણ સારામાં સારુ તો ધરમાં જ આપી શકાય. એ કલ્પી શકાય એવું છે કે જે ધાર્મિક સાંપ્રદાયો પોતાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા માંગતા હોય તેઓ ખાનગી રીતે એ શિક્ષણ આપે અવી સગવડ રાજ્યે કરી આપવી જોઈએ; માત્ર એવી કેળવણીનો ખર્ચ એ સાંપ્રદાયોએ ઉઠાવવો જોઈએ.”

ગાંધીજીની દીરવણીને અનુસરીને જાકીર હુસેન સમિતીએ એવું ઠરાવ્યું કે વર્ધી ચોજના હેઠળ સામાજિક અભ્યાસનો એક ઉદ્દેશ્ય દુનિયાના બધા ધર્મો માટે પરસ્પર આદર કેળવવાનો હોવો જોઈએ. ઈતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને વર્તમાન ઘટનાઓના અભ્યાસક્રમોની સાથે જગતના ભિન્ન ધર્મોનો, મૂળસિદ્ધ્યાંતોમાં એમની વચ્ચે કેવી મેળ છે તે બતાવવા માટે, કરેલો અભ્યાસ આ ઉદ્દેશ પાર પાડવામાં મદદ રૂપ થશે. પ્રેમ, સત્ય અને ન્યાય, સહકાર મૂલક પૂરુષાર્થ, રાષ્ટ્રીય એક્તા અને સાંસ્કૃતિક એક્તા તથા મનુષ્ય માત્રની સમાનતા અને બિરાદરી પર ભાર મૂકવો, સર્વ પ્રકારની હિંસા અને છળકપટ કરતાં શ્રેષ્ઠ છે. એ બતાવનારા પ્રસંગો ઈતિહાસ અને વર્તમાન જીવનમાંથી ખાસ વર્ગવી બતાવવાં.

આધ્યાત્મિક કેળવણી આપતાં ગાંધીજી ટોલ્સ્ટોય આશ્રમનાં બાળકોને ભજનો ગવડાવતાં તથા મોઢે કરાવતાં અને નીતિનાં પુસ્તકો વંચાવતા. એથી એમને સંતોષ થતો નહિ. માત્ર પુસ્તકોના જ્ઞાનથી આધ્યાત્મિક જ્ઞાન આપાય નહિ. તેમના મતે ધર્મનું પાલન કરનારા શિક્ષકો જ ધર્મનું શિક્ષણ આપી શકે. શિક્ષકો એ તેમના વિદ્યાર્થીઓ સાથે સાચા હદ્યના સંબંધો કેળવવા જોઈએ અને વર્ગાંડની બહાર તેમનો બધો સમય બાળકોના ચારિય ઘડતર માટે ફાળવવો જોઈએ.

ગાંધીજી કહે છે કે શાળાનું સમૂહજીવન વિદ્યાર્થીઓમાં ધાર્મિકતાની લાગણી કેળવવા માટેનું મહત્વનું સાધન છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના, વિદ્યાર્થી- વિદ્યાર્થી વચ્ચેના સંબંધોમાં સર્વ સામાન્ય તત્ત્વાના આચરણ માટે આપને સોનેરી તક મળી રહે છે. આવી શાળા દીવાદાંડીરૂપ થઈ પડશે અને વિશાળ સમાજ પર તેની દૂરગામી અસર થશે. આવા આદર્શની સિદ્ધ્યને માટે દિવસની શાળા કરતાં છાત્રાલય શાળા વધારે ઉપકારક છે. કારણ કે તે વિદ્યાર્થીઓના સમગ્ર જીવનને આવરી લે છે. ગાંધીજીના આ વિચારને સાકાર કરવા એન.સી.ટી.એ. પી.ટી.સી.માં ફરજિયાત છાત્રાલયનો નિયમ બનાવ્યો હતો પરંતુ કેટલાક કમનસીબ બનાવોને લઈને ગુજરાત સરકાર છાત્રાલય નિવાસ મરજિયાત બનાવ્યો છે.

ગાંધીજીના મતાનુસાર જીવન તરફનું ધાર્મિક વલણ પેદા કરવા માટે શિક્ષકનો અંગત પ્રમાણ એ સૌથી મહત્વનું સાધન છે એવા ગાંધીજીના મંત્રબ્યને સ્પેન્સ રિપોર્ટ પણ સમર્થન આપ્યું છે. તેમાં જીવનવામાં આવ્યું છે કે, ‘જેનો વિષય પરત્વે રસ તથા તે શીખવવાની ઈચ્છા ધાર્મિક શ્રદ્ધામાંથી ઉદ્ભવતા હોય તે શિક્ષક સર્વોત્તમ છે એ વિષે

માર્ગે જ શંકા ઉઠાવી શકાય.' ગાંધીજી એક ડગલું આગળ વધીને કહે છે કે, શિક્ષક જો એવા વલણવાળો ન હોય તો પોતાના મિશનમાં તે અવશ્ય નિર્જળ નીવડવાનો કારણ કે બાળકનાં વલણો મુખ્યત્વે કરીને 'સંભાળનુભૂતિ ભર્યો સંસર્ગ અને પ્રશંસાપાત્ર વ્યક્તિઓ તરફના સૂચનો ધ્વારા ઘડાય છે.

ઉપરોક્ત ચર્ચા પરથી સિદ્ધ કરી શકાય છે કે ગાંધીજીના ધર્મ વિષેના તથા શિક્ષણમાં તેના સ્થાન વિષેના વિચારો માનસશાસ્ત્રની વિચારણાના આધુનિક વલણોને અનુઝૂપ છે. ધાર્મિક શિક્ષણના ચર્ચાસ્પદ સવાલ પ્રત્યે તેમની દૃષ્ટિ અતિશય તાજગીભરી અને પ્રાગુવાન છે તથા આપુણા સાંસ્કૃતિક વારસાને અનુઝૂપ છે.

૫. ઉપસંહસ્ર

આપુણે સંકલ્પ કરીશું કે ...

૧. દેશને બિન સાંપ્રદાયિક અને અખંડ રાખીશું.
૨. આ દેશમાં કોઈ મુખ્ય નાગરિક નથી તેમ નથી કોઈ ગૌણ નાગરિક એવી સમજ વિકસાવીશું.
૩. ભારતનું રાજ્યબંધારણ એ સાર્વજનિક જીવનમાં બધાને લાગુ પાડનારો મહાગ્રંથ છે. નાગરિક સમાજ એને જ અનુસરશે.
૪. રાજ્યનો કોઈ સાંપ્રદાયિક ધર્મ નથી. તેને ઈક્ત એક જ ધર્મ છે અને તે પ્રજા ધર્મ, એ વાત વારંવાર રાજ્યતંત્રને પહોંચાડીશું.
૫. પ્રાર્થના-પૂજા-ઉપાસના ધરમાં થાય અને ધર્મ સ્થાનમાં એવી રીત થાય કે જેથી એ કોઈને નહે નહીં.
૬. કોઈ પણ સરકારી કાર્યક્રમમાં ધાર્મિક વિધિ કે કોઈ સાંપ્રદાયિક પૂજા પ્રાર્થના નહીં હોય.
૭. ધર્મને નામે ચાલતી કોઈ સંસ્થાના કે સંગઠનને સરકારી મદદ ન મળે, ધાર્મિક રજાઓ ઓછી કરવામાં આવે તથા જાહેર રજાઓ પણ વિવેકપૂર્વક ગોઠવાય તેવો આગ્રહ રાખીશું.
૮. ફટકડા, ટોલ-નગારા, લાઉડસ્પીકરો, પ્રદૂષણકારી આતિશબાજુઓ જેવા ધોંઘાટિયા ઉત્સવો અંકુશમાં રાહવા મથીશું.
૯. નવા ધર્મસ્થાનો ઉભા કરવા, બાંધવા માટે સરકારની પરવાનગી જરૂરી ગણાય એવો આગ્રહ રાખીશું.

આવતી કાલનું ભારત રમ્ભાળ મુક્ત, ભાષાચાર મુક્ત, પ્રદૂષણ મુક્ત અને હીન આચરણોથી મુક્ત બને એ આપુણી અંતિમ મંજીલ છે.

સંદર્ભ ગ્રંથો

૧. પંડ્યા, જ્યન્ત (સંપાદક) 'નાગરિક સમાજની દિશામાં'. પ્રકાશક : ગુજરાત લોક સમિતિ, લાલદરવાજા, અમદાવાદ.
૨. પટેલ, માણીભાઈ શિવામાઈ. 'મહાત્મા ગાંધીની કેળવણીની ફિલ્મસૂક્ષ્મ. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.
૩. પાગા, ફુજરાત. 'ભૂમિપુત્ર', વડોદરા.
૪. રાવલ, ગોવિંદભાઈ. 'ધર્મભીમાંસા.' ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
૫. શાહ, કાંતિ 'હિંદ સ્વરાજ'-એક અધ્યયન'. યજ્ઞ પ્રકાશન